

Extra No. 108



सत्यमेव जयते

# The Gujarat Government Gazette

## EXTRAORDINARY

### PUBLISHED BY AUTHORITY

Vol. LXV ] MONDAY, OCTOBER 28, 2024 / KARTIKA 6, 1946

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી ઓક્ટોબર, ૨૦૨૪

તારીખ: ૨૮મી ઓક્ટોબર, ૨૦૨૪ના ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા સન ૨૦૨૪ના ગુજરાત વટહુકમ ક્રમાંક: ૩નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારૂ પ્રસિદ્ધ કર્યો છે.

આર. આર. સોલંકી,  
સરકારના નાયબ સચિવ.



## નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી ઓક્ટોબર, ૨૦૨૪

## GUJARAT ORDINANCE NO. 3 OF 2024

## AN ORDINANCE

further to amend the Gujarat Goods and Services Tax Act, 2017.

સન ૨૦૨૪નો ગુજરાત વટહુકમ ક્રમાંક: ૩.

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ વધુ સુધારવા બાબત  
વટહુકમ.

સન ૨૦૧૭નો ૧૨મો. માલ અને સેવા વેરા કાઉન્સિલની ૫૩મી બેઠકોની ભલામણોને આધારે, કેન્દ્રીય માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ની અમુક જોગવાઈઓ, સંસદ દ્વારા નાણા અધિનિયમ, ૨૦૨૪ (ક્રમાંક. ૨)થી સુધારવામાં આવી છે;

સન ૨૦૧૭નો ૧૨મો. અને કેન્દ્રીય માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ અને ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ની જોગવાઈઓ લાગુ પાડવામાં એકરૂપતા જાળવવા માટે, ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, સન ૨૦૧૭નો ગુજરાતનો ૨૫મો. ૨૦૧૭ સુધારવાનું ઈષ્ટ છે;

અને ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ નથી;

સન ૨૦૧૭નો ગુજરાતનો ૨૫મો. અને ગુજરાતના રાજ્યપાલને એવી ખાતરી થઈ છે કે ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ સુધારવા માટે તાત્કાલિક પગલું લેવાનું તેમને માટે જરૂરી બનાવે તેવા સંજોગો પ્રવર્તે છે;

તેથી, હવે, ભારતના સંવિધાનના અનુચ્છેદ ૨૧૩ના ખંડ (૧)થી તેમને મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, નીચેનો વટહુકમ કરીને પ્રસિદ્ધ કરે છે:-

૧. ટૂંકી સંજ્ઞા અને આરંભ.- (૧) આ વટહુકમ ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વટહુકમ, ૨૦૨૪ કહેવાશે.
  - (૨) કલમો ૭, ૩૧, ૩૬ અને ૩૮ સન ૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનાની ૨૭મી તારીખે અમલમાં આવી હોવાનું ગણાશે અને બાકીની જોગવાઈઓ સન ૨૦૨૪ના નવેમ્બર મહિનાની ૧લી તારીખે અમલમાં આવી હોવાનું ગણાશે.
૨. સન ૨૦૧૭નો ગુજરાતનો ૨૫મો અધિનિયમ હંગામી રીતે સુધારવા બાબત.- આ વટહુકમના અમલની મુદત દરમિયાન, ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (જેનો આમાં હવે પછી, “મુખ્ય અધિનિયમ” તરીકે ઉલ્લેખ કર્યો છે તે)ની કલમો ૩થી ૩૮ માં નિર્દિષ્ટ કરેલ સુધારાને અધીન રહીને અમલમાં રહેશે.
૩. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૯નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૯માં, પેટા-કલમ (૧)માં, “માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લિકર” એ શબ્દો પછી, “અને માનવ વપરાશ માટેના આલ્કોહોલિક લિકરના ઉત્પાદન માટે ઉપયોગમાં લીધેલ અન-ડિનેચર્ડ એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ અથવા રેક્ટિફાઈડ સ્પિરિટ”, એ શબ્દો દાખલ કરવા.
૪. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૧૦નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૦માં, પેટા-કલમ (૫)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર દાખલ કરવા.
૫. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમમાં નવી કલમ ૧૧ક દાખલ કરવા બાબત.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૧ પછી, નીચેની કલમ દાખલ કરવી:-

સન ૨૦૧૭નો ગુજરાતનો ૨૫મો.

જનરલ પ્રેક્ટિસ  
(સામાન્ય પ્રથા)ના  
પરિણામે ન લેવાપાત્ર  
અથવા ઓછા લેવાપાત્ર  
માલ અને સેવા વેરો  
વસૂલ નહિ કરવાની સત્તા.

“૧૧૬. આ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, સરકારને એવી ખાતરી થાય કે,-

- (ક) કોઈ માલ અથવા સેવા અથવા તે બંનેના કોઈ પુરવઠા ઉપર રાજ્ય વેરો લેવાને (તે નહિ લેવા સહિતને) લગતી કોઈ પ્રેક્ટિસ (પ્રથા) પ્રવર્તમાન હતી અથવા સામાન્ય રીતે પ્રવર્તમાન છે; અને
- (ખ) (૧) સદરહુ પ્રેક્ટિસ (પ્રથા) અનુસાર રાજ્ય વેરો લેવાપાત્ર નહોતો અથવા લેવામાં આવતો નથી તેવા કિસ્સામાં, આવા પુરવઠા પર રાજ્ય વેરો, લેવાપાત્ર હતો અથવા લેવાપાત્ર થાય છે, અથવા
- (૨) સદરહુ પ્રેક્ટિસ (પ્રથા) અનુસાર લેવાપાત્ર થતી હતી અથવા લેવાપાત્ર થાય છે તેના કરતાં રાજ્ય વેરાની વધુ રકમ, આવા પુરવઠા પર, લેવાપાત્ર હતી અથવા લેવાપાત્ર થાય છે.

તો સરકાર, કાઉન્સિલની ભલામણોને આધારે, રાજપત્રમાં, જાહેરનામાથી, એવો આદેશ કરી શકશે કે એવા પુરવઠા પર ચૂકવવાપાત્ર સંપૂર્ણ રાજ્ય વેરો અથવા, યથાપ્રસંગ, તેવા પુરવઠા પર ચૂકવવાપાત્રથી વધુ રાજ્ય વેરો, પરંતુ સદરહુ પ્રેક્ટિસ (પ્રથા)ને કારણે, સદરહુ પ્રેક્ટિસ (પ્રથા) અનુસાર જે પુરવઠા પર રાજ્ય વેરો લેવાપાત્ર નહોતો અથવા લેવાપાત્ર નથી અથવા ઓછો લેવાપાત્ર થતો હતો અથવા થાય છે તેના સંબંધમાં તે ચૂકવવાપાત્ર થશે નહિ.

૬. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૧૩નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૩માં, પેટા-કલમ (૩)માં,-

- (૧) ખંડ (ખ)માં, “પુરવઠાકાર દ્વારા” એ શબ્દોને બદલે, “પુરવઠાકાર દ્વારા ભરતિયું કાઢી આપવાનું જરૂરી હોય તેવા કિસ્સામાં, પુરવઠાકાર દ્વારા; અથવા” એ શબ્દો મૂકવા;
- (૨) ખંડ (ખ) પછી, નીચેનો ખંડ દાખલ કરવો:-
- “ગ) પ્રાપ્તકર્તા (માલ લેનાર)એ ભરતિયું કાઢી આપવાનું હોય તે કિસ્સામાં પ્રાપ્તકર્તાએ કાઢી આપેલ ભરતિયાની તારીખ.”;
- (૩) પ્રથમ પરંતુકમાં, “અથવા ખંડ (ખ)” એ શબ્દો, કૌંસ અને અક્ષર પછી, “અથવા ખંડ (ગ)” એ શબ્દો, કૌંસ અને અક્ષર દાખલ કરવા.

૭. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૧૬નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૬માં, પેટા-કલમ (૪) પછી, નીચેની પેટા-કલમો દાખલ કરવી અને તે સન ૨૦૧૭ના જુલાઈ મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ હંમેશા દાખલ કરેલી હોવાનું ગણાશે:-

“(૫) પેટા-કલમ (૪)માં ગમે તે મજકૂર હોય તેમ છતાં, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ને લગતા માલ અથવા સેવા અથવા તે બંનેના પુરવઠા માટેનું ભરતિયું અથવા ઉધાર નોંધના સંબંધમાં, રજિસ્ટર થયેલી વ્યક્તિ, સન ૨૦૨૧ના નવેમ્બર મહિનાની ત્રીસમી તારીખ સુધીમાં, ફાઈલ કરેલ કલમ ૩૯ હેઠળના કોઈ પત્રક (રિટર્ન) હેઠળ ઈનપુટ વેરાશાખ લેવાને હકદાર રહેશે.

(૬) કલમ ૨૯ હેઠળ રજિસ્ટર થયેલી વ્યક્તિનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હોય અને કલમ ૩૦ હેઠળ અથવા અપીલ સત્તાધિકારી અથવા અપીલ ટ્રિબ્યુનલ અથવા કોર્ટ કરેલા કોઈ હુકમ અનુસાર રજિસ્ટ્રેશન રદ કરવાનું કોઈ હુકમથી રદબાતલ કરવામાં આવે અને રજિસ્ટ્રેશન રદ કરવાના હુકમની તારીખે પેટા-કલમ (૪) હેઠળ ભરતિયું અથવા ઉધાર નોંધના સંબંધમાં ઈનપુટ વેરા શાખનો લાભ લેવાનું મર્યાદિત ન હોય ત્યારે, કલમ ૩૯ હેઠળના પત્રકમાં માલ અથવા સેવા અથવા તે બંનેના પુરવઠા માટેના આવા ભરતિયા અથવા ઉધાર નોંધના સંબંધમાં,-

- (૧) એવું ભરતિયું અથવા ઉધાર નોંધ જે નાણાકીય વર્ષને લગતું હોય તે પછીના નવેમ્બર મહિનાની ત્રીસમી તારીખ સુધીમાં ફાઈલ કરેલ અથવા રજૂ કરેલ સંબંધિત વાર્ષિક પત્રક, એ બેમાંથી જે વહેલું હોય તે; અથવા

(૨) રજિસ્ટ્રેશન રદ કરવાની તારીખથી અથવા યથાપ્રસંગ, રજિસ્ટ્રેશન રદ કરવાની અમલી તારીખથી, રજિસ્ટ્રેશન રદ કરવાનું રદબાતલ કરવાના હુકમની તારીખ સુધી, રજિસ્ટ્રેશન રદ કરવાનું રદબાતલ કરવાના હુકમની તારીખથી ત્રીસ દિવસ સુધીમાં પત્રક (રિટર્ન) ફાઇલ કરેલ હોય, તે બેમાંથી જે મોડું હોય, તે મુદત માટે,

સદરહુ વ્યક્તિ, ઈનપુટ વેરાશાખ લેવાને હકદાર રહેશે.”.

૮. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૧૭નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૭માં, પેટા-કલમ (૫)માં, ખંડ (૧)માં, “કલમો ૭૪, ૧૨૯ અને ૧૩૦”, એ શબ્દો અને આંકડાને બદલે, “નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધીની કોઈ મુદતના સંબંધમાં કલમ ૭૪” એ શબ્દો અને આંકડા મૂકવા.

૯. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૨૧નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૨૧માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર દાખલ કરવા.

૧૦. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૩૦નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૦માં, પેટા-કલમ (૨)માં, પરંતુક પછી, નીચેનો પરંતુક ઉમેરવો:-

“પરંતુ રજિસ્ટ્રેશન રદ કરવા અંગેનું આવું રદબાતલ, ઠરાવવામાં આવે તેવી શરતો અને નિયંત્રણોને અધીન રહેશે.”.

૧૧. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૩૧નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૧માં,-

(ક) પેટા-કલમ (૩)માં, ખંડ (છ)માં, “કલમ ૮ની પેટા-કલમ (૩) અથવા પેટા-કલમ (૪) હેઠળ, વેરો ભરવા માટે જવાબદાર હોય તેવી કોઈ રજિસ્ટર થયેલી વ્યક્તિએ,” એ શબ્દો, કૌંસ, આંકડા અને અક્ષર પછી, “ઠરાવવામાં આવે તેટલી મુદતની અંદર,” એ શબ્દો દાખલ કરવા;

(ખ) ખંડ (જ) પછી, નીચેનું સ્પષ્ટીકરણ દાખલ કરવું:-

“સ્પષ્ટીકરણ.- ખંડ (છ)ના હેતુઓ માટે, “રજિસ્ટર થયેલા ન હોય તેવા પુરવઠાકાર” એ શબ્દપ્રયોગમાં, કલમ ૫૧ હેઠળ વેરાની કપાતના હેતુ માટે જ કેવળ રજિસ્ટર થયેલા હોય તેવા પુરવઠાકારનો સમાવેશ થશે.”.

૧૨. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૩૫નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૫માં, પેટા-કલમ (દ)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર દાખલ કરવા.

૧૩. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૩૯નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૯માં, પેટા-કલમ (૩)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી:-

“(૩) કલમ ૫૧ હેઠળ મૂળ સ્થાને વેરાની કપાત કરવી જરૂરી હોય તેવી દરેક રજિસ્ટર થયેલી વ્યક્તિએ, ઠરાવવામાં આવે તેવા નમૂનામાં અને તેવી રીતે, તેટલા સમયની અંદર, દરેક કેલેન્ડર મહિના દરમિયાન કરેલી કપાતોના તે મહિના માટેનું પત્રક, ઈલેક્ટ્રોનિક સ્વરૂપે રજૂ કરવું જોઈશે:

પરંતુ સદરહુ રજિસ્ટર થયેલ વ્યક્તિએ, દરેક કેલેન્ડર મહિના દરમિયાન કોઈ કપાત કરવામાં આવેલી હોય કે ન હોય તેવા સદરહુ મહિના માટે પત્રક રજૂ કરવું જોઈશે.”.

૧૪. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૪૯નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૪૯માં, પેટા-કલમ (૮)માં, ખંડ (ગ)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર ઉમેરવા.

૧૫. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૫૦નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૫૦માં, પેટા-કલમ (૧)ના પરંતુકમાં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર દાખલ કરવા.
૧૬. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૫૧નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૫૧માં, પેટા-કલમ (૭)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર ઉમેરવા.
૧૭. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૫૪નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૫૪માં,-
- (ક) પેટા-કલમ (૩)માં, દ્વિતીય પરંતુક કમી કરવો;
- (ખ) પેટા-કલમ (૧૪) પછી, નીચેની પેટા-કલમ દાખલ કરવી:-
- “(૧૫) આ કલમમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, શૂન્ય-દરનો માલનો પુરવઠો નિકાસ વેરાને અધીન હોય, ત્યારે શૂન્ય-દરના માલના પુરવઠાને કારણે વણવપરાયેલી ઈનપુટ વેરા શાખનું અથવા શૂન્ય-દરના માલના પુરવઠાને કારણે ચૂકવેલા સંકલિત વેરાનું કોઈ રિફંડ આપવું જોઈશે નહિ.”.
૧૮. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૬૧નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૬૧માં, પેટા-કલમ (૩)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર ઉમેરવા.
૧૯. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૬૨નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૬૨માં, પેટા-કલમ (૧)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર દાખલ કરવા.
૨૦. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૬૩નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૬૩માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર દાખલ કરવા.
૨૧. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૬૪નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૬૪માં, પેટા-કલમ (૨)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર ઉમેરવા.
૨૨. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૬૫નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૬૫માં, પેટા-કલમ (૭)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર ઉમેરવા.
૨૩. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૬૬નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૬૬માં, પેટા-કલમ (૬)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર ઉમેરવા.
૨૪. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૭૦નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૭૦માં, પેટા-કલમ (૧) પછી, નીચેની પેટા-કલમ દાખલ કરવી:-
- “ (૧ક) પેટા-કલમ (૧) હેઠળ બોલાવવામાં આવેલી તમામ વ્યક્તિઓ, આવો અધિકારી આદેશ કરે તેમ, રૂબરૂ અથવા અધિકૃત પ્રતિનિધિ દ્વારા હાજરી આપવા બંધાયેલી રહેશે અને તેવી રીતે હાજર થનારી વ્યક્તિએ, તપાસ દરમિયાન સત્ય જણાવવાનું રહેશે અથવા નિવેદનો આપવાના રહેશે અથવા ફરમાવવામાં આવે તેવા દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ રજૂ કરવાના રહેશે.”.
૨૫. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૭૩નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૭૩માં,-

- (૧) હાંસિયાના શીર્ષકમાં, “વેરો ન ચૂકવવા અથવા ઓછો વેરો ભરવા અથવા ભૂલથી રિફંડ આપવા અથવા ઈનપુટ વેરા શાખ ખોટી રીતે લેવા અથવા ઉપયોગ કરવાની બાબત અંગે નિર્ણય કરવા” એ શબ્દોને બદલે, “નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધીની મુદતને લગતો વેરો ન ચૂકવવા અથવા ઓછો વેરો ભરવા અથવા ભૂલથી રિફંડ આપવા અથવા ઈનપુટ વેરા શાખ ખોટી રીતે લેવા અથવા ઉપયોગ કરવાની બાબત અંગે નિર્ણય કરવા” એ શબ્દો અને આંકડા દાખલ કરવા;
- (૨) પેટા-કલમ (૧૧) પછી, નીચેની પેટા-કલમ ઉમેરવી:-  
 “(૧૨) આ કલમની જોગવાઈઓ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધીની મુદતને લગતા વેરાનો નિર્ણય કરવા માટે લાગુ પડશે.”.

૨૬. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૭૪નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૭૪માં,-

- (૧) હાંસિયાના શીર્ષકમાં, “વેરો ન ચૂકવવા અથવા ઓછો વેરો ભરવા અથવા ભૂલથી રિફંડ આપવા અથવા ઈનપુટ વેરા શાખ ખોટી રીતે લેવા અથવા ઉપયોગ કરવાની બાબત અંગે નિર્ણય કરવા” એ શબ્દોને બદલે, “નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધીની મુદતને લગતો વેરો ન ચૂકવવા અથવા ઓછો વેરો ભરવા અથવા ભૂલથી રિફંડ આપવા અથવા ઈનપુટ વેરા શાખ ખોટી રીતે લેવા અથવા ઉપયોગ કરવાની બાબત અંગે નિર્ણય કરવા” એ શબ્દો અને આંકડા દાખલ કરવા;
- (૨) પેટા-કલમ (૧૧) પછી અને સ્પષ્ટીકરણ ૧ પહેલાં, નીચેની પેટા-કલમ દાખલ કરવી:-  
 “(૧૨) આ કલમની જોગવાઈઓ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધીની મુદતને લગતા વેરાનો નિર્ણય કરવા માટે લાગુ પડશે.”.
- (૩) સ્પષ્ટીકરણ ૨ કમી કરવું.

૨૭. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની નવી કલમ ૭૪ક દાખલ કરવા બાબત.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૭૪ પછી, નીચેની કલમ દાખલ કરવી:-

સન ૨૦૨૪-૨૫ પછીના નાણાકીય વર્ષને લગતો, કોઈ કારણસર વેરો ન ચૂકવવા અથવા ઓછો ભરવા અથવા ભૂલથી રિફંડ આપવા અથવા ઈનપુટ વેરા શાખ ખોટી રીતે લેવા અથવા ઉપયોગ કરવાની બાબત અંગે નિર્ણય કરવા બાબત.

“૭૪ક. (૧) યોગ્ય અધિકારીને એમ જણાય કે કોઈ વેરો ચૂકવવામાં આવ્યો નથી અથવા ઓછો ભરેલો છે અથવા ભૂલથી રિફંડ આપેલ છે અથવા ઈનપુટ વેરા શાખ ખોટી રીતે મેળવેલ છે અથવા ઉપયોગ કરેલ છે, ત્યારે તેણે એવી વેરાપાત્ર વ્યક્તિ કે જેણે વેરો ચૂકવેલ ન હોય અથવા ઓછો ચૂકવેલ હોય અથવા જેને ભૂલથી રિફંડ આપેલ હોય અથવા જેણે ખોટી રીતે ઈનપુટ વેરા શાખ લીધી હોય અથવા ઉપયોગ કરેલ હોય તેવી વ્યક્તિને, નોટિસમાં નિર્દિષ્ટ કરેલી રકમ તેમજ કલમ ૫૦ હેઠળ તેની ઉપર ચૂકવવાપાત્ર વ્યાજની રકમ અને આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા નિયમોની જોગવાઈઓ હેઠળ વસૂલાતપાત્ર દંડ તેણે શા માટે ભરવો જોઈએ નહિ તેવી કારણદર્શક નોટિસ બજાવવી જોઈશે:

પરંતુ નાણાકીય વર્ષમાં જે વેરો ચૂકવવામાં આવ્યો ન હોય અથવા ઓછો ભરેલો હોય અથવા ભૂલથી રિફંડ આપેલ હોય તે વેરો અથવા ઈનપુટ વેરા શાખ ખોટી રીતે લીધેલી હોય અથવા ઉપયોગ કરેલ હોય ત્યારે તે, રૂપિયા એક હજાર કરતાં ઓછી હોય, તો કોઈ નોટિસ આપવી જોઈશે નહિ.

- (૨) યોગ્ય અધિકારીએ, જે નાણાકીય વર્ષ માટે વેરો ચૂકવેલો ન હોય અથવા ઓછો ભરેલો હોય અથવા ભૂલથી રિફંડ આપેલ હોય તે વેરો અથવા ઈનપુટ વેરા શાખ ખોટી રીતે લીધેલી હોય અથવા ઉપયોગ કરેલ હોય તે નાણાકીય વર્ષ માટે વાર્ષિક પત્રક રજૂ કરવા માટેની નિયત તારીખથી બેતાલીસ મહિનાની અંદર, અથવા ભૂલથી રિફંડ આપ્યા તારીખથી બેતાલીસ મહિનાની અંદર પેટા-કલમ (૧) હેઠળની નોટિસ બજાવવી જોઈશે.
- (૩) પેટા-કલમ (૧) હેઠળ કોઈ મુદત માટે નોટિસ કાઢવામાં આવેલ હોય, ત્યારે યોગ્ય અધિકારી, પેટા-કલમ (૧) હેઠળ આવરી લીધેલ મુદત સિવાયની મુદતો માટે ન ભરેલ કે ઓછા ભરેલ વેરા અથવા ભૂલથી કરેલા રિફંડની અથવા ખોટી રીતે લીધેલ અથવા ઉપયોગમાં લીધેલી ઈનપુટ વેરા શાખની વિગતો ધરાવતું પત્રક, વેરાપાત્ર વ્યક્તિ ઉપર બજાવી શકશે.

- (૪) પેટા-કલમ (૧) હેઠળ આવરી લીધી હોય તે સિવાયની વેરા મુદત આધારિત કારણો, અગાઉની નોટિસમાં જણાવ્યા હોય તે જ છે તે શરતને અધીન રહીને, પેટા-કલમ (૧) હેઠળ આવા પત્રકની બજવણી, આવી વ્યક્તિને નોટિસ બજાવી હોવાનું ગણાશે.
- (૫) કોઈ વેરો નહિ ચૂકવેલો અથવા ઓછા ચૂકવેલો અથવા ભૂલથી રિફંડ આપેલો હોય અથવા ઈનપુટ વેરા શાખનો ખોટી રીતે લાભ લીધેલ અથવા ઉપયોગ કરેલ ત્યારે,-
- (૧) વેરો ટાળવા માટે, છળકપટ અથવા જાણીબૂજીને કોઈ ખોટું નિવેદન અથવા હકીકતો છુપાવવાના કારણ સિવાયના કોઈ કારણસર આવી વ્યક્તિ પાસેથી લેવાપાત્ર બાકી વેરાના દસ ટકા જેટલી રકમ અથવા દસ હજાર રૂપિયા, એ બન્નેમાંથી જે વધુ હોય તેટલો દંડ (પેનલ્ટી) રહેશે;
- (૨) વેરો ટાળવા માટે, છળકપટ અથવા જાણીબૂજીને કોઈ ખોટું નિવેદન અથવા હકીકતો છુપાવવાના કારણસર આવી વ્યક્તિ પાસેથી લેવાપાત્ર બાકી વેરાની રકમ જેટલો દંડ (પેનલ્ટી) રહેશે,
- (૬) યોગ્ય અધિકારીએ, વેરો લેવાપાત્ર વ્યક્તિએ કોઈ રજૂઆત કરી હોય તો, તે ધ્યાનમાં લઈને, આવી વ્યક્તિ પાસેથી બાકીની વેરા, વ્યાજ અને દંડની રકમ નક્કી કરીને, હુકમ કરવો જોઈશે.
- (૭) યોગ્ય અધિકારીએ, પેટા-કલમ (૨)માં નિર્દિષ્ટ નોટિસ આપ્યાની તારીખથી બાર મહિનાની અંદર પેટા-કલમ (૬) હેઠળ હુકમ કરવો જોઈશે:

પરંતુ યોગ્ય અધિકારી નિર્દિષ્ટ મુદતની અંદર હુકમ કરી શકે તેમ ન હોય ત્યારે, કમિશનર અથવા યોગ્ય અધિકારીના દરજ્જાથી સિનિયર દરજ્જાના પરંતુ સંયુક્ત રાજ્ય વેરા કમિશનરના દરજ્જાથી ઉતરતા દરજ્જાના નહિ તેવા કમિશનરે અધિકૃત કરેલા કોઈ અધિકારી, પેટા-કલમ (૬) હેઠળ હુકમ કરવાના વિલંબના કારણોને લક્ષમાં લેતાં, લેખિતમાં કારણોની નોંધ કરીને, નિર્દિષ્ટ મુદત પૂરી થાય તે પહેલાં સદરહુ મુદત વધુમાં વધુ છ મહિના સુધી લંબાવી શકશે.

- (૮) વેરો ટાળવા માટે, છળકપટ અથવા જાણીબૂજીને કોઈ ખોટું નિવેદન અથવા હકીકતો છુપાવવાના કારણ સિવાયના કોઈ કારણસર કોઈ વેરો નહિ ચૂકવેલો અથવા ઓછા ચૂકવેલો અથવા ભૂલથી રિફંડ આપેલ હોય અથવા ઈનપુટ વેરા શાખનો ખોટી રીતે લાભ લીધેલ અથવા ઉપયોગ કરેલ ત્યારે, વેરો લેવાપાત્ર વ્યક્તિ,-
- (૧) પેટા-કલમ (૧) હેઠળ નોટિસની બજવણી થયા પહેલાં કલમ ૫૦ હેઠળ ચૂકવવાપાત્ર વ્યાજ સાથે તેણે પોતે નક્કી કર્યાના આધારે અથવા યોગ્ય અધિકારીએ નક્કી કર્યા પ્રમાણેના વેરાને આધારે આવા વેરાની રકમ ચૂકવીને, આવી ચૂકવણીની યોગ્ય અધિકારીને લેખિતમાં જાણ કરી શકશે અને યોગ્ય અધિકારીએ, આવી જાણકારી મળ્યે, આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા નિયમોની જોગવાઈઓ હેઠળ આવી રીતે ચૂકવેલ વેરાના સંબંધમાં અથવા ચૂકવવાપાત્ર કોઈ દંડના સંબંધમાં પેટા-કલમ (૧) હેઠળ કોઈ નોટિસ બજવવી જોઈશે નહિ અથવા યથાપ્રસંગ, પેટા-કલમ (૩) હેઠળ પત્રક બજાવવું જોઈશે નહિ;
- (૨) કારણદર્શક નોટિસ આપ્યાના સાઠ દિવસની અંદર કલમ ૫૦ હેઠળ ચૂકવવાપાત્ર વ્યાજ સાથે સદરહુ વેરો ચૂકવી શકશે અને આમ કરવાથી, કોઈ દંડ ચૂકવવાપાત્ર થશે નહિ અને સદરહુ નોટિસના સંબંધમાં તમામ કાર્યવાહીઓ પૂરી થયેલી હોવાનું ગણાશે.
- (૯) વેરો ટાળવા માટે, છળકપટ અથવા જાણીબૂજીને કોઈ ખોટું નિવેદન અથવા હકીકતો છુપાવવાના કારણસર કોઈ વેરો નહિ ચૂકવેલો અથવા ઓછા ચૂકવેલો અથવા ભૂલથી રિફંડ આપેલો હોય અથવા ઈનપુટ વેરા શાખનો ખોટી રીતે લાભ લીધેલ અથવા ઉપયોગ કરેલ ત્યારે, વેરો લેવાપાત્ર વ્યક્તિ,-



- (૧) પેટા-કલમ (૧) હેઠળ નોટિસની બજવણી થયા પહેલાં કલમ ૫૦ હેઠળ ચૂકવવાપાત્ર વ્યાજ સાથે તેણે પોતે નક્કી કર્યાના આધારે અથવા યોગ્ય અધિકારીએ નક્કી કર્યા પ્રમાણેના વેરાને આધારે આવા વેરાની રકમ ચૂકવીને, આવી ચૂકવણીની યોગ્ય અધિકારીને લેખિતમાં જાણ કરી શકશે અને યોગ્ય અધિકારીએ, આવી જાણકારી મળ્યે, આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા નિયમોની જોગવાઈઓ હેઠળ આવી રીતે ચૂકવેલ વેરાના સંબંધમાં અથવા ચૂકવવાપાત્ર કોઈ દંડના સંબંધમાં પેટા-કલમ (૧) હેઠળ કોઈ નોટિસ બજવવી જોઈશે નહિ અથવા યથાપ્રસંગ, પેટા-કલમ (૩) હેઠળ પત્રક બજાવવું જોઈશે નહિ;
- (૨) નોટિસ આપ્યાના સાઠ દિવસની અંદર કલમ ૫૦ હેઠળ ચૂકવવાપાત્ર વ્યાજ સાથે સદરહુ વેરો તેમજ આવા વેરાના પચીસ ટકા રકમ જેટલો દંડ ચૂકવી શકશે અને આમ કરવાથી, સદરહુ નોટિસના સંબંધમાં તમામ કાર્યવાહીઓ પૂરી થયેલી હોવાનું ગણાશે;
- (૩) હુકમની જાણ કર્યાના સાઠ દિવસની અંદર કલમ ૫૦ હેઠળ ચૂકવવાપાત્ર વ્યાજ સાથે સદરહુ વેરો તેમજ આવા વેરાના પચાસ ટકા રકમ જેટલો દંડ ચૂકવી શકશે અને આમ કરવાથી, સદરહુ નોટિસના સંબંધમાં તમામ કાર્યવાહીઓ પૂરી થયેલી હોવાનું ગણાશે.
- (૧૦) યોગ્ય અધિકારીનો એવો અભિપ્રાય હોય કે, પેટા-કલમ (૮)ના ખંડ (૧) અથવા પેટા-કલમ (૯)ના ખંડ (૧) હેઠળ ચૂકવેલી રકમ ખરેખર ચૂકવવાપાત્ર રકમથી ઓછી છે ત્યારે, તેઓએ, ખરેખર ચૂકવવાપાત્ર રકમથી ઓછી હોય તેવી રકમના સંબંધમાં પેટા-કલમ (૧)માં જોગવાઈ કર્યા પ્રમાણે નોટિસ આપવાની કાર્યવાહી કરવી જોઈશે.
- (૧૧) પેટા-કલમ (૮)ના ખંડ (૧) અથવા ખંડ (૨)-માં ગમે તે મજકૂર હોય તેમ છતાં, સ્વ-આકારણી કરેલા વેરાની કોઈપણ રકમ અથવા વેરા તરીકે વસૂલ કરેલી કોઈપણ રકમ, આવા વેરાની ચૂકવણીની નક્કી કરેલી તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર ચૂકવેલી ન હોય ત્યારે, પેટા-કલમ (૫)ના ખંડ (૧) હેઠળનો દંડ ચૂકવવાપાત્ર થશે.
- (૧૨) આ કલમની જોગવાઈઓ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પછીના વેરાનો નિર્ણય કરવા માટે લાગુ પડશે.

**સ્પષ્ટીકરણ ૧.-** આ કલમના હેતુઓ માટે,-

- (૧) “સદરહુ નોટિસના સંબંધમાં તમામ કાર્યવાહીઓ” એ શબ્દપ્રયોગમાં, કલમ ૧૩૨ હેઠળની કાર્યવાહીઓનો સમાવેશ થશે નહિ;
- (૨) તે જ કાર્યવાહીઓ હેઠળ નોટિસ, વેરો ચૂકવવાને જવાબદાર મુખ્ય વ્યક્તિને અને કેટલીક બીજી વ્યક્તિઓને આપવામાં આવી હોય અને મુખ્ય વ્યક્તિ સામેની કાર્યવાહીઓ આ કલમ હેઠળ પૂરી કરવામાં આવી હોય ત્યારે, કલમો ૧૨૨ અને ૧૨૫ હેઠળ દંડ ચૂકવવાને જવાબદાર તમામ વ્યક્તિઓ સામેની કાર્યવાહીઓ પૂરી થયેલી હોવાનું ગણાશે.

**સ્પષ્ટીકરણ ૨.-** આ અધિનિયમના હેતુઓ માટે, “માહિતી છુપાવવી” એ શબ્દપ્રયોગનો અર્થ, કોઈ વેરાપાત્ર વ્યક્તિએ આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા નિયમો હેઠળ પત્રક, નિવેદન, અહેવાલ અથવા પૂરા પાડેલ અન્ય કોઈ દસ્તાવેજમાં જાહેર કરવાનું જરૂરી હોય તેવી હકીકતો અથવા માહિતી જાહેર ન કરવી અથવા યોગ્ય અધિકારીએ જે માહિતી માંગેલી હોય તે માહિતી લેખિતમાં પૂરી ન પાડવી એવો થશે.

**૨૮. સન ૨૦૧૭ના ગુજરાત અધિનિયમ ક્રમાંક. ૨૫ની કલમ ૭૫નો સુધારો.-** મુખ્ય અધિનિયમમાં, કલમ ૭૫માં,-

- (ક) પેટા-કલમ (૧)માં, “ અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ની પેટા-કલમો (૨) અને (૧૦)-માં” એ શબ્દો, અક્ષરો, આંકડા અને કૌંસને બદલે, “ અથવા કલમ ૭૪ની પેટા-કલમો (૨) અને (૧૦) અથવા યથાપ્રસંગ, કલમ ૭૪ક-ની પેટા-કલમો (૨) અને (૭)-માં” એ શબ્દો, અક્ષરો, આંકડા અને કૌંસ મૂકવા;

- (ખ) પેટા-કલમ (૨) પછી, નીચેની પેટા-કલમ દાખલ કરવી:-  
 “(૨ક). કોઈ અપીલ સત્તાધિકારી અથવા અપીલ ટ્રિબ્યુનલ અથવા કોર્ટ એવા નિષ્કર્ષ પર આવે કે કલમ ૭૪ક-ની પેટા-કલમ (૫)ના ખંડ (૨) હેઠળનો દંડ જે વ્યક્તિની સામે આવી નોટિસ કાઢવામાં આવી હોય તેની સામેના વેરો ટાળવા માટે છળકપટ અથવા જાણીબૂજીને કોઈ ખોટું નિવેદન અથવા હકીકતો છુપાવવાના આરોપો સાબિત થયેલ નથી તે કારણસર, ટકી શકે તેમ નથી ત્યારે, કલમ ૭૪ક-ની પેટા-કલમ (૫)ના ખંડ (૧) હેઠળ એવી વ્યક્તિ દ્વારા દંડ ચૂકવવાપાત્ર થશે.”;
- (ગ) પેટા-કલમ (૧૦)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી:-  
 “(૧૦) કલમ ૭૩ની પેટા-કલમ (૧૦) અથવા કલમ ૭૪ની પેટા-કલમ (૧૦) અથવા કલમ ૭૪ક-ની પેટા-કલમ (૭)-માં નિર્દિષ્ટ મુદતની અંદર હુકમ કરવામાં ન આવે તો, ન્યાયનિર્ણય કાર્યવાહીઓ પૂરી થયેલી હોવાનું ગણાશે.”;
- (ઘ) પેટા-કલમ (૧૧)માં, “કલમ ૭૪” એ શબ્દ અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક-ની પેટા-કલમ (૭)” એ શબ્દો દાખલ કરવા;
- (ચ) પેટા-કલમ (૧૨)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર દાખલ કરવા;
- (છ) પેટા-કલમ (૧૩)માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર દાખલ કરવા.
૨૯. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૧૦૪નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૦૪માં, પેટા-કલમ (૧)માં, સ્પષ્ટીકરણમાં, “કલમ ૭૪” એ શબ્દ અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક-ની પેટા-કલમ (૨) અને (૭)” એ શબ્દો, કૌંસ, આંકડા અને અક્ષર ઉમેરવા;
૩૦. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૧૦૭ નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૦૭માં,-  
 (ક) પેટા-કલમ (૬)માં, ખંડ (ખ)માં, “પચીસ” એ શબ્દને બદલે, “વીસ” એ શબ્દ મૂકવો;  
 (ખ) પેટા-કલમ (૧૧)માં, બીજા પરંતુકમાં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર ઉમેરવા.
૩૧. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૧૦૮ નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૦૮માં, “ફેરતપાસ સત્તાધિકારી” એ શબ્દો પછી, “અથવા તપાસ હાથ ધરવા અથવા સદરહુ કલમ હેઠળ જાહેર કરવામાં આવ્યું હોય તો, કલમ ૧૭૧ની પેટા-કલમ (૨)માં ઉલ્લેખેલા કેસોના ચૂકાદા આપવા” એ શબ્દો દાખલ કરવા.
૩૨. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૧૧૨ નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૧૨માં,-  
 (ક) પેટા-કલમ (૧)માં, “જેની સામે અપીલ કરવા ધાર્યું હોય તેવા હુકમની જાણ અપીલ કરતી વ્યક્તિને કરવામાં આવે તે તારીખથી” એ શબ્દો પછી, “; અથવા આ અધિનિયમ હેઠળ અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરવા માટે, કાઉન્સિલની ભલામણોને આધારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તે તારીખે, તે બેમાંથી જે મોડું હોય તે,” એ શબ્દો ઉમેરવા અને તે સન ૨૦૨૪ના ઓગસ્ટ મહિનાની ૧લી તારીખે અમલમાં આવે તે રીતે હંમેશાથી ઉમેર્યા હોવાનું ગણાશે;
- (ખ) પેટા-કલમ (૩)માં, “જે તારીખે સદરહુ હુકમ કરવામાં આવ્યો હોય તે તારીખથી” એ શબ્દો પછી, “અથવા આ અધિનિયમ હેઠળ અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરવાના હેતુ માટે, કાઉન્સિલની ભલામણોને આધારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તે તારીખે, તે બેમાંથી જે મોડું હોય તે,” એ શબ્દો દાખલ કરવા અને તે સન ૨૦૨૪ના ઓગસ્ટ મહિનાની ૧લી તારીખે અમલમાં આવે તે રીતે હંમેશાથી દાખલ કર્યા હોવાનું ગણાશે;

(ગ) પેટા-કલમ (દ)માં, “પેટા-કલમ (૧)માં ઉલ્લેખેલ મુદત પૂરી થયા પછી” એ શબ્દો, કૌંસ અને આંકડા પછી, “અથવા પેટા-કલમ (૩)માં ઉલ્લેખેલ મુદત પૂરી થયા પછી ત્રણ મહિનાની અંદર અરજી કરવાની પરવાનગી” એ શબ્દો દાખલ કરવા;

(ઘ) પેટા-કલમ (૮)માં, ખંડ (ખ)માં,-

(૧) “વીસ ટકા” એ શબ્દોને બદલે, “દસ ટકા” એ શબ્દો મૂકવા;

(૨) “પચાસ કરોડ રૂપિયા” એ શબ્દોને બદલે, “વીસ કરોડ રૂપિયા” એ શબ્દો મૂકવા.

૩૩. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૧૨૨નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, પેટા-કલમ (૧ખ)માં, “તેવા ઈલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર” એ શબ્દોને બદલે, “કલમ ૫૨ હેઠળ સ્થળ પર વેરો વસૂલવા માટે જવાબદાર હોય તેવા ઈલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર” એ શબ્દો અને આંકડા દાખલ કરવા અને તે સન ૨૦૨૩ના ઓક્ટોબર મહિનાની ૧લી તારીખે અમલમાં આવે તે રીતે હંમેશાથી બદલ્યા હોવાનું ગણાશે;

૩૪. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૧૨૭નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૨૭માં, “કલમ ૭૩ અથવા કલમ ૭૪” એ શબ્દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શબ્દો, આંકડા અને અક્ષર દાખલ કરવા.

૩૫. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમમાં નવી કલમ ૧૨૮ક દાખલ કરવા બાબત.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૨૮ પછી, નીચેની કલમ દાખલ કરવી:-

અમુક વેરા મુદતો માટે, કલમ ૭૩ હેઠળ કરાયેલ માંગણીના સંબંધમાં વેરો અથવા દંડ અથવા તે બંનેની માફી બાબત.

“૧૨૮ક. (૧) આ અધિનિયમમાં, વિરુદ્ધનો ગમે તે મજકૂર હોય તેમ છતાં, કોઈ વ્યક્તિએ નીચે મુજબ વેરાની રકમ ચૂકવવાપાત્ર થતી હોય ત્યારે,-

(ક) કલમ ૭૩ની પેટા-કલમ (૧) હેઠળ કાઢેલી નોટિસ અથવા કલમ ૭૩ની પેટા-કલમ (૩) હેઠળ કાઢેલ પત્રક, અને કલમ ૭૩ની પેટા-કલમ (૮) હેઠળ કોઈ હુકમ કાઢવામાં આવેલ ન હોય; અથવા

(ખ) કલમ ૭૩ની પેટા-કલમ (૮) હેઠળ પસાર કરેલ હુકમ અને કલમ ૧૦૭ની પેટા-કલમ (૧૧) અથવા કલમ ૧૦૮ની પેટા-કલમ (૧) હેઠળ કોઈ હુકમ પસાર કરવામાં આવેલ ન હોય; અથવા

(ગ) કલમ ૧૦૭ની પેટા-કલમ (૧૧) હેઠળ અથવા કલમ ૧૦૮ની પેટા-કલમ (૧) હેઠળ પસાર કરેલ હુકમ, અને અથવા કલમ ૧૧૩ની પેટા-કલમ (૧) હેઠળ કોઈ હુકમ પસાર કરવામાં આવેલ ન હોય, ત્યારે,-

૧લી જુલાઈ, ૨૦૧૭ થી ૩૧મી માર્ચ, ૨૦૨૦ સુધી અથવા તેના કોઈ ભાગને લગતી મુદતને લગતા, અને સદરહુ વ્યક્તિ કાઉન્સિલની ભલામણોને આધારે સરકાર જાહેર કરે તેવી તારીખે અથવા તે પહેલાં, ખંડ (ક), ખંડ (ખ) અથવા યથાપ્રસંગ, ખંડ (ગ)માં ઉલ્લેખેલ નોટિસ અથવા પત્રક અથવા હુકમ મુજબ ચૂકવવાપાત્ર વેરાની પૂરેપૂરી રકમ ચૂકવે તો, કલમ ૫૦ હેઠળનું કોઈ વ્યાજ અને આ અધિનિયમ હેઠળનો કોઈ દંડ ચૂકવવાપાત્ર થશે નહિ અને સદરહુ નોટિસ અથવા હુકમ અથવા યથાપ્રસંગ, પત્રકના સંબંધમાં, ઠરાવવામાં આવે તેવી શરતોને અધીન રહીને કાર્યવાહીઓ સમાપ્ત થયેલી હોવાનું ગણાશે.

પરંતુ કલમ ૭૪ની પેટા-કલમ (૧) હેઠળ નોટિસ કાઢવામાં આવી હોય અને કલમ ૭૫ની પેટા-કલમ (૨)ની જોગવાઈઓ અનુસાર અપીલ સત્તાધિકારી અથવા અપીલ ટ્રિબ્યુનલ અથવા કોર્ટના આદેશ અનુસાર યોગ્ય અધિકારીએ હુકમ પસાર કરેલ હોય અથવા પસાર કરવાનું જરૂરી હોય ત્યારે, સદરહુ નોટિસ અથવા હુકમ, આ પેટા-કલમના ખંડ (ક) અથવા ખંડ (ખ)માં ઉલ્લેખ્યા પ્રમાણે નોટિસ અથવા હુકમ ગણાશે.

વધુમાં, કલમ ૧૦૭ની પેટા-કલમ (૩) હેઠળ અથવા કલમ ૧૧૨ની પેટા-કલમ (૩) હેઠળ અરજી કરવામાં આવી હોય અથવા કલમ ૧૧૭ની પેટા-કલમ (૧) હેઠળ અથવા કલમ ૧૧૮ની પેટા-કલમ (૧) હેઠળ રાજ્ય વેરાના અધિકારીએ અપીલ ફાઈલ કરેલ હોય અથવા ખંડ (ખ) અથવા

ખંડ (ગ)માં ઉલ્લેખેલ હુકમની વિરુદ્ધ અથવા પ્રથમ પરંતુકમાં ઉલ્લેખેલ અપીલ સત્તાધિકારી અથવા અપીલ ટ્રિબ્યુનલ અથવા કોર્ટના આદેશો વિરુદ્ધ કલમ ૧૦૮ની પેટા-કલમ (૧) હેઠળ શરૂ કરવામાં આવેલી કોઈ કાર્યવાહીઓ, સદરહુ વ્યક્તિ, અપીલ સત્તાધિકારી અથવા અપીલ ટ્રિબ્યુનલ અથવા યથાપ્રસંગ, કોર્ટના હુકમ અનુસાર, ચૂકવવાપાત્ર વેરાની વધારાની રકમ, કોઈ હોય તો તે, સદરહુ હુકમની તારીખથી ત્રણ મહિનાની અંદર ચૂકવે તે શરતને અધીન રહેશે:

વળી, આવું વ્યાજ અને દંડ ચૂકવી દીધેલ હોય તો, તેનું કોઈ રિફંડ મળશે નહિ.

- (૨) પેટા-કલમ (૧)માંનો કોઈપણ મજકૂર, ભૂલથી ચૂકવાયેલ રિફંડના સંબંધમાં વ્યક્તિએ ચૂકવવાપાત્ર રકમના સંબંધમાં લાગુ પડશે નહિ.
- (૩) પેટા-કલમ (૧)માંનો કોઈપણ મજકૂર સદરહુ વ્યક્તિએ કરેલી અપીલ અથવા રિટ પિટિશન અપીલ સત્તાધિકારી અથવા અપીલ ટ્રિબ્યુનલ અથવા યથાપ્રસંગ, કોર્ટ સમક્ષ પડતર હોય અને પેટા-કલમ (૧) હેઠળ જાહેર કરેલી તારીખે અથવા તે પહેલાં સદરહુ વ્યક્તિએ એ તે પાછી ખેંચેલ ન હોય તેવા કેસોના સંબંધમાં લાગુ પડશે નહિ.
- (૪) આ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, પેટા-કલમ (૧) હેઠળ નિર્દિષ્ટ કરેલી કોઈ રકમ ચૂકવી દીધેલ હોય અને સદરહુ કલમો હેઠળ કાર્યવાહીઓ સમાપ્ત થયેલી ગણાતી હોય ત્યારે, કલમ ૧૦૭ની પેટા-કલમ (૧) હેઠળ, અથવા કલમ ૧૧૨ની પેટા-કલમ (૧) હેઠળ કોઈ અપીલ, પેટા-કલમ (૧)ના ખંડ (ખ) અથવા યથાપ્રસંગ, ખંડ (ગ)માં ઉલ્લેખેલ હુકમની સામે કરી શકાશે નહિ.

૩૬. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની કલમ ૧૭૧નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૭૧માં,

- (ક) પેટા-કલમ (૨) માં, નીચેનો પરંતુક અને સ્પષ્ટીકરણ દાખલ કરવા:-

"પરંતુ કેન્દ્ર સરકાર, કાઉન્સિલની ભલામણોને આધારે, જાહેરનામાથી, જે તારીખથી સદરહુ સત્તામંડળે કોઈપણ રજિસ્ટર થયેલી વ્યક્તિએ મેળવેલ ઈનપુટ વેરા શાખ અથવા વેરા દરમાં ઘટાડાથી ખરેખર તેણે પૂરા પાડેલ માલ અથવા સેવાઓ અથવા તે બંનેની કિંમતમાં સમપ્રમાણ ઘટાડામાં પરિણમેલ છે કે કેમ તે અંગેની તપાસ માટેની કોઈપણ વિનંતી સ્વીકારવી જોઈશે નહીં તે તારીખ નિર્દિષ્ટ કરી શકશે.

સ્પષ્ટીકરણ.- આ પેટા-કલમના હેતુઓ માટે, "તપાસ માટેની વિનંતી" નો અર્થ કોઈપણ રજિસ્ટર થયેલ વ્યક્તિએ મેળવેલ ઈનપુટ વેરા શાખ અથવા વેરા દરમાં ઘટાડો ખરેખર તેણે પૂરો પાડેલ માલ અથવા સેવાઓ અથવા તે બંનેની કિંમતમાં સમપ્રમાણ ઘટાડામાં પરિણમેલ છે કે કેમ તે અંગે તપાસ માટે વિનંતી કરતી અરજદારે ફાઈલ કરેલી લેખિત અરજી થશે.":

- (ખ) સ્પષ્ટીકરણને, તેના સ્પષ્ટીકરણ ૧ તરીકે ફરી નંબર આપવો અને એવી રીતે ફરી નંબર આપેલ સ્પષ્ટીકરણ ૧ પછી, નીચેનું સ્પષ્ટીકરણ ઉમેરવું:-

"સ્પષ્ટીકરણ ૨.- આ કલમના હેતુઓ માટે, "સત્તાધિકારી" એ શબ્દમાં "અપીલ (એપેલેટ) ટ્રિબ્યુનલ" નો સમાવેશ થશે".

૩૭. સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા અધિનિયમની અનુસૂચિ ૩નો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, અનુસૂચિ ૩ માં, પરિચ્છેદ ૮ પછી અને સ્પષ્ટીકરણ ૧ પહેલાં, નીચેના પરિચ્છેદો દાખલ કરવા:-

"૮. મુખ્ય વીમાદાતા, વીમાધારકે ચૂકવેલ પ્રીમિયમની સંપૂર્ણ રકમ પરનો કેન્દ્રીય વેરો, રાજ્ય વેરો, સંઘ પ્રદેશ વેરો, સંકલિત વેરો ચૂકવે છે એ શરતને અધીન રહીને, સહ-વીમા કરારોમાં વીમાધારકને, મુખ્ય વીમાદાતા અને સહ-વીમાદાતા દ્વારા સંયુક્ત રીતે પૂરી પાડેલ વીમા સેવાઓ માટે મુખ્ય વીમાદાતા દ્વારા સહ-વીમાદાતાને (આપવાના) સહ-વીમા પ્રીમિયમના વિભાજનની પ્રવૃત્તિ.

૧૦. વીમાદાતા દ્વારા પુનઃવીમાદાતાને ચૂકવવાપાત્ર કુલ રિઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર રિઇન્શ્યોરર દ્વારા સદરહુ સીડિંગ કમિશન અથવા રિઇન્શ્યોરન્સ કમિશન સહિત કેન્દ્રીય વેરો, રાજ્ય વેરો, સંઘ પ્રદેશ વેરો અને સંકલિત વેરો ચૂકવવામાં આવતો હોય, એ શરતને અધીન રહીને, જે સેવાઓ માટે વીમાદાતાએ પુનઃવીમાદાતાને ચૂકવેલ પુનઃવીમા પ્રીમિયમમાંથી સીડિંગ કમિશન અથવા પુનઃવીમા કમિશનમાંથી કાપવામાં આવતું હોય તેવી વીમાદાતાએ પુનઃવીમાદાતાને આપેલ સેવાઓ.

૩૮. ચૂકવેલ વેરા અથવા ઉલટાવેલ ઈનપુટ વેરા શાખનું કોઈ રિફંડ ન આપવા બાબત.- કલમ ૭ તમામ મહત્વપૂર્ણ સમયે અમલમાં હોત તો, એવી રીતે ચૂકવવામાં આવ્યા ન હોત અથવા ઉલટાવવામાં આવેલ ન હોત તેવા ચૂકવવામાં આવેલ તમામ વેરા અથવા ઉલટાવેલ ઈનપુટ વેરા શાખનું કોઈ રિફંડ આપવામાં આવશે નહીં.

## નિવેદન

માલ અથવા સેવાઓ અથવા તે બંનેના રાજ્યાંતર્ગત (રાજ્યની અંદર) પુરવઠા પર ગુજરાત સરકાર દ્વારા વેરો લેવા અને તેની વસૂલાત કરવા માટેની જોગવાઈ કરવાના ઉદ્દેશથી ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ અધિનિયમિત કરવામાં આવ્યો હતો.

માલ અને સેવા વેરા કાઉન્સિલ દ્વારા તેની ૫૩-મી બેઠકમાં, માલ અને સેવા વેરા કાયદામાં સુધારાની આવશ્યકતા દર્શાવતા જુદા-જુદા નિર્ણયો લેવામાં આવ્યા છે. તદનુસાર, સંસદ દ્વારા નાણા(ક્રમાંક ૨) અધિનિયમ, ૨૦૨૪ (સન ૨૦૨૪ના ૧૫મા)થી, કેન્દ્રીય માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ૧૨મા) અને સંકલિત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ૧૩મા) અને માલ અને સેવા વેરા (રાજ્યોને વળતર) અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭નાં ૧૫મા)માં સુધારા કરવામાં આવ્યા છે. માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોનો શક્ય તેટલો જલદી અમલ કરવા અને કેન્દ્રીય માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ અને ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)ની જોગવાઈઓ લાગુ પાડવામાં એકરૂપતા જળવાય તે માટે, ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ સુધારવો ઈષ્ટ છે.

ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી, ઉપર્યુક્ત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે, ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ સુધારવા ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વટહુકમ, ૨૦૨૪ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ગાંધીનગર,

તારીખ: ૨૭મી ઓક્ટોબર, ૨૦૨૪.

આચાર્ય દેવવ્રત,

ગુજરાતના રાજ્યપાલ.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

ડૉ. ટી. નટરાજન,

સરકારના અગ્ર સચિવ.

